

વોટરવૂ રિજન વેક્સીન ટાસ્ક ફોર્સ 12 થી 17 વર્ષની વયનાં યુવક/યુવતીઓને અને તેમની સાથે રહેતા કુટુંબના સભ્યો (જેમણે COVID-19 વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો નથી)ને રસી અપાવવામાં મદદ કરે છે. યુવક/યુવતીઓએ રસી લેવી એ COVID-19 ના ફેલાવાને મર્યાદિત કરવામાં મદદરૂપ થવા માટે અને જ્યારે આપણે રૂબરૂ શાળામાં જઈએ ત્યારે તેને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ છે.

## હવે કોણ રસી મેળવી શકે છે?

12 થી 17 વર્ષની વયનાં યુવક/યુવતીઓ હવે [COVID-19 રસી માટે પૂર્વ નોંધણી](#) **pre-register for a COVID-19 vaccine** કરાવી શકે છે. યુવક/યુવતીઓ અને જેમની સાથે તેઓ રહે છે તે કુટુંબના સભ્યો 7 મી જૂનથી 20 મી જૂન વચ્ચે તેમના પ્રથમ ડોઝ માટે સમયની નોંધણી કરાવી શકશે. **તેમની એપોઇન્ટમેન્ટના સમયે યુવક/યુવતીની ઉંમર અચૂક 12 વર્ષ હોય જ એ આવશ્યક છે.** સંભવ છે કે યુવક/યુવતી અન્ય લોકોની તુલનામાં પોતાનો બીજો ડોઝ વધારે ઝડપથી મેળવી શકશે, જેથી 2021ના શાળા-વર્ષ પહેલા તેમણે બંને ડોઝ લઈ લીધા હશે. હાલના સમયે, કુટુંબના સભ્યો બીજો ડોઝ વધારે ઝડપથી નથી મેળવી શકતા, સિવાય કે તેઓ અન્ય [લાયક પ્રાથમિકતા](#) **eligible priority** જૂથનો ભાગ ન હોય.

## કઈ રસી આપવામાં આવશે?

હેલ્થ કેનેડાએ 12 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના કોઇપણ માટે ફાઇઝરની COVID-19 Pfizer-BioNTech રસી મંજૂર કરી છે. વધુ માહિતી માટે નીચેનાં સંસાધનો જુઓ.

- [COVID-19 Vaccines for Youth](#) **યુવાવ્યક્તિઓ માટેની રસીઓ**
- [Child and Youth COVID-19 Vaccine Fact Sheet](#) **બાળક અને યુવાવ્યક્તિની COVID-19 રસીનું માહિતી પત્રક**
- [COVID-19 Vaccine FAQs](#) **COVID-19ની રસી અંગેના વારંવાર પૂછાતા પ્રશ્નો**

## પૂર્વ-નોંધણી કેવી રીતે કરાવવી?

[COVID-19 રસી માટે પૂર્વ નોંધણી](#) કરાવવા અહીં ક્લિક કરો **pre-register for a COVID-19 vaccine**

- ફૂપા કરીને પ્રાયોરિટી ગ્રુપ તરીકે **“youth 12-17 years of age”** પસંદ કરો.
- યુવક/યુવતીની અંગત વિગતો સાથે ફોર્મ સંપૂર્ણ ભરો, કુટુંબના સભ્યોએ કોઇ ફોર્મ ભરવાની જરૂર નથી
- જ્યારે યુવક/યુવતીને પોતાનો બુકિંગ કોડ મળે, ત્યારે એક જ ઘરના કુટુંબના સભ્યો તેમના પ્રથમ ડોઝ માટે સમય બુક કરવા માટે એ જ બુકિંગ કોડનો ઉપયોગ કરી શકે છે.

જો ફોર્મ ભરવામાં તમારે મદદની જરૂર હોય તો ફૂપા કરીને આ વીડિયો જુઓ [watch the video about how to fill out the form](#), અથવા તમે જેમના પર ભરોસો મૂકી શકતા હોવ એવા કોઇને કહો. જો તમારે અધિક મદદની જરૂર હોય તો, 519-575-4400 પર ફોન કરો, 200 ઉપરાંત ભાષાઓમાં સહાય ઉપલબ્ધ છે. બધિર અને ઓછી શ્રવણ શક્તિવાળાઓ માટે (TTY): 519-575-4608.

જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમે જે રીતે તે મેળવવાનું કહ્યું હશે, તે રીતે તમને તમારો બુકિંગ કોડ મળશે. કૃપા કરીને તમારા ઇમેઇલમાં નિયમિતપણે તમારું JUNK/SPAM ફોલ્ડર ચકાસશો.

જ્યારે તમને તમારો બુકિંગ કોડ મળે, ત્યારે કૃપા કરીને તમારો ટાઇમ સ્લોટ શક્ય એટલી વહેલી તકે બુક કરશો. જો કુટુંબના સભ્યોએ વોટરલૂ પબ્લિક હેલ્થના ક્ષેત્રમાં અગાઉથી નોંધણી કરાવી હોય, તો તેઓ પોતાના યુવક/યુવતીએ પ્રાપ્ત કરેલા બુકિંગ કોડથી જ એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે અને તે પછી તેમને અગાઉ મળેલ બુકિંગ કોડને રદ કરી દેવો.

### યુવક/યુવતી પોતાની વેક્સીન ક્યાંથી મેળવી શકે છે?

યુવક/યુવતીએ તે ક્લિનિકમાં સમય બુક કરવાની જરૂર છે જ્યાં ફાઇઝર રસી આપવામાં આવતી હોય. એપોઇન્ટમેન્ટ બુક કરતી વખતે કૃપા કરીને નીચેની ક્લિનિક્સમાંથી એક પસંદ કરો:

- કેમ્બ્રિજ પાઇનબુશ, કેમ્બ્રિજ
- હેલ્થ સાયન્સિસ કેમ્પસ, કિયનર
- ધી બ્રોડવોક, વોટરલૂ
- વેલ્સ્લી ક્લિનિક, વેલ્સ્લી
- ન્યૂ વિઝન FHT, કિયનર

ક્લિનિક્સ ક્યાં આવી છે એ જોવા અમારો રસીકરણ નકશો જુઓ [COVID-19 Vaccination Clinics](#)

### Map

યુવક/યુવતીઓએ તેમની એપોઇન્ટમેન્ટના દિવસે પોતાનું હેલ્થ કાર્ડ લાવવું જોઈશે. જો તેમની પાસે હેલ્થ કાર્ડ ન હોય, તો કૃપા કરીને ઓળખની બીજી સામગ્રી લાવવી કે જે પુષ્ટિ કરે કે તેઓ કોણ છે અને તેના પર નંબર / કોડ હોય. તમારી એપોઇન્ટમેન્ટ પહેલાં અને પછી શું કરવું તે વિશે વધુ જાણવા માટે વોટરલૂ ક્ષેત્રમાં COVID-19 રસીકરણ ક્લિનિક્સની મુલાકાત [COVID-19 Vaccination Clinics in Waterloo Region](#) પેજ પર લેશો.

*[insert name of Board or school]* જેઓ પોતાની વેક્સીન મેળવવા લાયક હોય [pre-register to receive their vaccine](#) એ તમામને પૂર્વ નોંધણી કરાવવા પ્રોત્સાહિત કરે છે. શક્ય હોય ત્યારે, અને તેમના શિક્ષણમાં તમારા બાળકને શ્રેષ્ઠ રીતે ટેકો કરવા માટે, કૃપા કરીને શાળાના ક્લાકો અંગેનું ધ્યાન રાખશો. જો કે, જો તમે ફક્ત શાળાના દિવસ દરમિયાન જ એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકતા હો, તો કૃપા કરીને એમ કરશો. આપણા સમુદાયના બધાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની આ એક મહત્વપૂર્ણ તક છે.

આપણા સમુદાયને સુરક્ષિત રાખવામાં આપના નિરંતર સમર્થન બદલ આભાર.

આભાર સહ,

*[person with signing authority for the school]*